### JINDAL HOTELS LIMITED



Date: 21<sup>st</sup> July, 2022

To, DSC-CRD BSE Limited, Code No. 7918 Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400 001

#### Scrip Code No. 507981

#### <u>Re:</u>- Notice to Equity shareholders of the Company published in newspaper

<u>Sub:</u> Transfer of Shares of shareholders who have not claimed dividend for 7 consecutive years to IEPF - Compliance under Regulation 47 of SEBI (LODR) Regulations, 2015.

Dear Sir,

In accordance with Section 124(6) of the Companies Act, 2013 read with Rule 6 of the IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Amendment Rules, 2016 as amended from time to time and pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has published Notice in following newspapers on 21<sup>st</sup> July, 2022 (i.e. Business Standard [English edition] and Vadodara Samachar, [Gujarati edition]. As per the Amended Rules, the due date for transfer of Equity Shares is October 27, 2022. The company had also sent communication on 19<sup>th</sup> July, 2022 to all the shareholders who have not claimed dividend. Therefore Notice is given to the shareholders that the Company will proceed to initiate action whose Dividend unclaimed for financial year 2014-2015 onwards without any further notice as per the amended Rules.


And also the said information is updated on Company website <u>www.suryapalace.com</u>. The Company has **uploaded full details of such shareholders** and shares due for transfer to IEPF on its **website**.

Please find enclosed Notice published in the Newspaper. Kindly acknowledge the same

Thanking You, For Jindal Hotels Limited Lim 6 Mansi Vyas **Company Secretar** 

**Encl: As Above** 

Date



	DEVELOPMENT F DRPORATION LTD.	).		ii Shoppers, Opp. Imperial Square, Adajan- Adajan, Surat-395 009 Ph.No.0261-4141212		4	Rs 17,24,867,02/	/- Shree Bhavani	-60,Aare-70,Aakar Rs.13.50 Town Planning Admeasurin Piki Northern Side Sub Plo Admeasuring 2342sq.Mts Tunki,City Of Surat All The Piece And Parcel	ng 4313 Sq.Mts t No.1 With Cop Of Moje Village Of The Property		8 <sup>th</sup> Aug 2022 6 <sup>th</sup> A	
POSSESSION NOTICE Hazira Road, Adajan, Surat-395 009 Ph.No.0261-4141212 Whereas the Authorised Officer/s of Housing Development Finance Corporation Limited, under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of							Demand Notice Date:05-Mar-201	19 Mangilal Sigar & Chhotidevi Chimanlal Sigar	Consisting Flat No A/40. Complex Opp Sonal Resid Survey No. 88/1+2, Block Parvat Patiya, Surat-394211	dency, Revenue	4,18,985/- 1,41,898.5/-	11.00 TO 1.00 11.00 PM	PM
he said Act, calling upon the following an an experiment of the second states the second states and the second second second states and the second seco	ng borrower(s) / ner with interest	/ L̀egal H t thereon	leir(s) and Legal R at the applicable	Representative(s) to pay the amounts mention of rates as mentioned in the said notices, within 60 c till the date of payment and / or realisation.		5	Rs 19,04,158.5/- Demand Notice Date:02-Dec-201	Dhirubhai V Savaliya 9 & Piyushbhai	All the piece and parcel consisting of immovable p Flat No. 304 admeasuring 65.03 sg. mtrs. Super built of	property, bearing 1 700 sq. fts. i.e.		8 <sup>th</sup> Aug 2022 6 <sup>th</sup> A 11.00 TO 1.00 11.00 PM	ug 2022   TO 1.00 PM
<ul> <li><sup>n</sup> Name of Borrower (s) / Legal Heir(s)</li> <li>and Legal Representative(s)</li> </ul>	Outstanding I Dues I Rs. as on Dt	Demand	Date of Possession/ Physical /Symbolic	Description of Immovable Property (ies) / Secured Asset (s)					up area admeasuring 5 alongwith undivided shar 52.64 sq.mtrs. alongwith	e admeasuring			
. Rajan Prakash, Singh Amarjitkumar (Guarantor) 116931 - 604216134	Rs. 8,11,518/- AS ON 31-MAR-2022	11- MAR-22	Symbolic 19.07.2022	301 (Building "B"), Shri Shyamsunder Park Chsl, R.S No. 80/1, 81, Nr Gayatri Marble, Opp Akshar, Apt, Amrol To Chhaprabhata Rd, Chapra Bhatha, Surat-394105.					admeasuring 17.00 sq. mtrs Third Floor, "Hare Krish situated at bearing Avenue S	s. in ground land, na Apartment", Survey No. 6/1-7,			
Thummar Bhavesh Girdharbhai , Thummar Champaben Girdharbhai 117023 - 645060059, 645971061, 645060066	Rs.6,98,790/-, Rs.20,469/- & Rs.2,96,296/- AS ON 31-MAR-2022	29- APR-22	Physical 19.07.2022	Flat-G-103, Floor-1, Shiv Residency - G – Wing, S.No 92, Opp. Shiv Bunglows, Nr. Saurashtra Green City Velanja Road, Umaragam, Olpad, Surat – 394540.					Block No. 5, T.P Scheme No. 1 Original Plot No. 5, Final P Sub Plot No. 4 admeasuring of Moje: Motavarachha, City	lot No. 6 paikee 624.62 sq. mtrs. of Surat			
Babubhai Savliya, Father of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) And Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Hansaben Babubhai Savliya, Mother of Savliya	Rs.20,06,461/-	29- APR-22	Symbolic 19.07.2022	Row House-30, Ram Vatika Bunglow, S.No. 176, 177 Block 214, B/h Mota Varachha, Rangoli Chokdi, Sayar Rd, Velanja, Surat - 394150.		<u>ass</u>		te that the said notice is issue at the immovable property.			C FIRST Bank Limited ha	Authorize	Sd/- d Officer c Limited
	1 1					) र्वंक	ऑफ़ बड़ौदा	T Baroda Citv	Region, Recover	v Departme	nt VEH	IICLE AU	ICTION
Pareshkumar B [Since Deceased] And Other Known and Unknown Legal Heir(s) And Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mrs. Bhumika, Wife of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased],Mr. Om Savliya, Son of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of					belo	Ban Ban We of the de Win exercise BRE IS & AS Name &	k of Baroda fault committed e of the powers IS WHAT IS BA	Suraj Plaza- Vadodara - 3 I by the Borrower ment s conferred under Hyp SIS" and subject to the to Description of the	3, 5th Floor, Saya 90005 ioned below, Bank has othecation Agreement erms & conditions mer (1) Reserve Price &	s repossessed/ executed by the tioned in Detail	seized the Hypothe ne parties and sam ed Vehicle Auction N f Inspection Date	e is being auction Notice E-auction	icle mentione oned on "AS Is
Other Known and Unknown Legal Heir(s) And Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mrs. Bhumika, Wife of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mr. Om Savliya, Son of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased] 116719 - 616228536					belo <sup>.</sup> WHE	ew of the de w in exercise ERE IS & AS Name & Borrowe & Gur	k of Baroda fault committed e of the powers IS WHAT IS BA Address of r/Directors arantors	Suraj Plaza- Vadodara - 3 I by the Borrower ment s conferred under Hyp SIS" and subject to the t Description of the Movable Assets for sale	3, 5th Floor, Saya 90005 ioned below, Bank has othecation Agreement erms & conditions mer	ijigunj, s repossessed/ executed by ti ntioned in Detail Date & time of Deposit of Tender/EMD	seized the Hypothe ne parties and sam ed Vehicle Auction N f Inspection Date & Time of the Vehicle	cated Motor Vel e is being auctio lotice E-auction date & time	E icle mentione oned on "AS IS Branch Na and Mobile
Other Known and Unknown Legal Heir(s) And Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mrs. Bhumika, Wife of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased],Mr. Om Savliya, Son of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased] 116719-616228536 J. Sidhdhapura Harshadbhai Lalitbhai, Sidhdhapura Dakshaben Lalitbhai 128921 - 635941489, 637054106, 637054034, 635941575	Rs.42,658/- & Rs.5,60,925/- AS ON 31-MAR-2022	29- APR-22	Physical 19.07.2022	Row House-60, Divyalok Residency, S.No. 390, 390/1 Block 328, Nr. Green Park, Nr. Kathor Gram Panchayat Kathor to Dhaludi Road, Kathor, Kamrej, Surat 394150.	belo WHE	ew of the de w in exercise ERE IS & AS Name & Borrowe & Gur	k of Baroda fault committed e of the powers IS WHAT IS BA Address of r/Directors arantors anhaviben Ibhai	Suraj Plaza- Vadodara - 3 by the Borrower ment s conferred under Hyp SIS" and subject to the t Description of the Movable Assets for sale Maruti Wagon R VXI petrol Registration no : GJ 06 LK 6037 Year of Mfg. 2018 Parked at address	3, 5th Floor, Saya 90005 ioned below, Bank has othecation Agreement erms & conditions mer (1) Reserve Price & (2) EMD Amount of	ijigunj, s repossessed/ executed by ti titioned in Detail Date & time of Deposit of	seized the Hypothe ne parties and sam ed Vehicle Auction N f Inspection Date & Time of the Vehicle 23/08/2022	cated Motor Veł e is being auctio lotice E-auction	E icle mentione oned on "AS Is Branch Na and Mobile Khodiyar N M No.
Other Known and Unknown Legal Heir(s) And Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mrs. Bhumika, Wife of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mr. Om Savliya, Son of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased] Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased] 116719 - 616228536 J. Sidhdhapura Dakshaben Lalitbhai, Sidhdhapura Dakshaben Lalitbhai 128921 - 635941489, 637054106,	Rs.19,167/-, Rs.42,658/- & Rs.5,60,925/- AS ON 31-MAR-2022 Rs.41,950/- & Rs.18,05,362/- AS ON			Block 328, Nr. Green Park, Nr. Kathor Gram Panchayat Kathor to Dhaludi Road, Kathor, Kamrej, Surat	belo WHE	Ban w of the de w in exercise RE IS & AS Name & Borrowe & Gue Smt. Ja Naresh	k of Baroda fault committed e of the powers IS WHAT IS BA Address of r/Directors arantors anhaviben Ibhai	Suraj Plaza- Vadodara - 3 d by the Borrower ment s conferred under Hyp SIS" and subject to the t Description of the Movable Assets for sale Maruti Wagon R VXI petrol Registration no : GJ 06 LK 6037 Year of Mfg. 2018	3, 5th Floor, Saya 90005 ioned below, Bank has othecation Agreement erms & conditions mer (1) Reserve Price & (2) EMD Amount of the Vehicle Rs.2,50,000/- Rs.25,000/- Bid increment Rs.10,000/-	jigunj, s repossessed/ executed by ti tioned in Detail Date & time of Deposit of Tender/EMD 25/08/2022	seized the Hypothe ne parties and sam ed Vehicle Auction N f Inspection Date & Time of the Vehicle 23/08/2022 f 02.00 pm	cated Motor Vel e is being auction lotice E-auction date & time 26/08/2022 From 02.00 P	E icle mentioned oned on "AS IS Branch Nar and Mobile M Khodiyar N M No.
Other Known and Unknown Legal Heir(s) And Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mrs. Bhumika, Wife of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mr. Om Savliya, Son of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased] 116719 - 616228536 . Sidhdhapura Harshadbhai Lalitbhai, Sidhdhapura Dakshaben Lalitbhai 128921 - 635941489, 637054106, 637054034, 635941575 Gohil Jaydip Kanjibhai 127149 - 622580089, 622040955 with further interest as applicable, in However, since the borrower/s /Legal Heir Authorised Officer/s of HDFC have taken pi exercise of powers conferred on him/them the borrower(s) /Legal Heir(s) and Legal R o deal with the aforesaid Immovable Prope subject to the mortgage of Housing Deve Borrower(s) /Legal Heir(s) / Legal Represer ime available to redeem the secured asset/	Rs.19,167/-, Rs.42,658/- & Rs.5,60,925/- AS ON 31-MAR-2022 Rs.41,950/- & Rs.18,05,362/- AS ON 31-MAR-2022 cicidental expense (s) and Legal Repr hysical/Symbolic p under Section 13 (4 tepresentative(s) n erty(ies)/Secured A elopment Finance in ntative(s) attentior (s.	APR-22 29- APR-22 ses, costs presentative possessio 4) of the sa mentioned Asset(s) ar Corporation	19.07.2022 Physical 19.07.2022 s, charges etc incr re(s) mentioned here e(s) mentioned here in of the immovable p aid Act read with Rule hereinabove in parti nd any dealings with on Ltd. vited to the provision	Block 328, Nr. Green Park, Nr. Kathor Gram Panchayat Kathor to Dhaludi Road, Kathor, Kamrej, Surat 394150. Row House-139, Opera Homes 2, S.No. 394, Block 384 Nr. Dada Bhagyan Temple, Nr. Shiv Nagar, Kamrej Surat-394185. urred till the date of payment and / or realization. inabove have failed to repay the amounts due, notice is nabove in particular and to the public in general that the property(ies)/secured asset(s) described herein above in 8 of the said Rules on the dates mentioned above. icular and the public in general are hereby cautioned not the said Immovable Property (ies)/Secured Asset(s) will as of sub-section (8) of section 13 of the Act, in respect of	belo WHE	Ban w of the de w in exercise ERE IS & AS Name & Borrowe & Gui Smt. Ja Naresh Pahelv	k of Baroda fault committed e of the powers IS WHAT IS BA Address of r/Directors anhaviben bhai ani bekshaben jit	Suraj Plaza- Vadodara - 3 by the Borrower ment s conferred under Hyp SIS" and subject to the t Description of the Movable Assets for sale Maruti Wagon R VXI petrol Registration no : GJ 06 LK 6037 Year of Mfg. 2018 Parked at address C- 17 DarpanVatika Society Laxmipura	3, 5th Floor, Saya 390005 ioned below, Bank has othecation Agreement terms & conditions mer (1) Reserve Price & (2) EMD Amount of the Vehicle Rs.2,50,000/- Rs.25,000/- Bid increment Rs.1,75,000/- Rs.17,500/- Bid Increment Rs.10,000/-	jigunj, s repossessed/ executed by ti tioned in Detail Date & time of Deposit of Tender/EMD 25/08/2022	seized the Hypothe ne parties and sam ed Vehicle Auction N f Inspection Date & Time of the Vehicle 23/08/2022 n To 4.00 M	cated Motor Vel e is being auction lotice E-auction date & time 26/08/2022 From 02.00 P	E icle mentione oned on "AS I Branch Na and Mobile M Khodiyar N M No. 990902308 M Karelibag M No.
Other Known and Unknown Legal Heir(s) And Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mrs. Bhumika, Wife of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased], Mr. Om Savliya, Son of Savliya Pareshkumar B [Since Deceased] and Other Known and Unknown Legal Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased] Heir(s) and Legal Representative(s) of Savliya Pareshkumar B [Since Deceased] 116719 - 616228536 I. Sidhdhapura Harshadbhai Lalitbhai, Sidhdhapura Dakshaben Lalitbhai 128921 - 635941489, 637054106, 637054034, 635941575 I. Gohil Jaydip Kanjibhai 127149 - 622580089, 622040955 I. With further interest as applicable, in However, since the borrower/s /Legal Heir Authorised Officer/s of HDFC have taken pf exercise of powers conferred on him/them u The borrower(s)/Legal Heir(s) and Legal Represer Borrower(s)/Legal Heir(s) / Legal Represer ime available to redeem the secured asset/ Copies of the Pnachanma drawn and I	Rs.19,167/-, Rs.42,658/- & Rs.5,60,925/- AS ON 31-MAR-2022 Rs.41,950/- & Rs.18,05,362/- AS ON 31-MAR-2022 cicidental expens (s) and Legal Repr hysical/Symbolic p cicidental expens (s) and Legal Repr hysical/Symbolic p entylies)/Secured A elopment Finance in ntative(s) attentior (s. Inventory made a	APR-22 29- APR-22 ses, costs resentative possessio 4) of the sa mentioned Asset(s) ar Corporatio n is/are inv are availab	19.07.2022 Physical 19.07.2022 s, charges etc increations (s) mentioned herein (s) mentioned	Block 328, Nr. Green Park, Nr. Kathor Gram Panchayat Kathor to Dhaludi Road, Kathor, Kamrej, Surat 394150. Row House-139, Opera Homes 2, S.No. 394, Block 384 Nr. Dada Bhagvan Temple, Nr. Shiv Nagar, Kamrej Surat-394185. urred till the date of payment and / or realization. inabove have failed to repay the amounts due, notice is nabove in particular and to the public in general that the property(ies)/secured asset(s) described herein above in 8 of the said Rules on the dates mentioned above. icular and the public in general are hereby cautioned no the said Immovable Property (ies)/Secured Asset(s) wil	belo WHE Sr. No. 1 2 Bidd	Ban We of the de win exercise RE IS & AS Name & Borrowe & Gur Smt. Ja Naresh Pahelv Smt. Ag Satyam Choksh	k of Baroda fault committed e of the powers IS WHAT IS BA Address of r/Directors anhaviben bhai ani bekshaben jit ni	Suraj Plaza- Vadodara - 3 by the Borrower ment s conferred under Hyp SIS" and subject to the t Description of the Movable Assets for sale Maruti Wagon R VXI petrol Registration no : GJ 06 LK 6037 Year of Mfg. 2018 Parked at address C- 17 DarpanVatika Society Laxmipura Road Gorwa Vadodara Maruti Omni E MPI STD BS IV Registration NO: GJ 06 LS 3149 Year of Mfg. 2018 Parked At Adress C- 17 DarpanVatika Society Laxmipura	3, 5th Floor, Saya 390005 ioned below, Bank has othecation Agreement terms & conditions mer (1) Reserve Price & (2) EMD Amount of the Vehicle Rs.2,50,000/- Rs.25,000/- Bid increment Rs.17,500/- Bid Increment Rs.17,500/- Bid Increment Rs.10,000/-	Jigunj, s repossessed/ executed by the totioned in Detail Date & time of Deposit of Tender/EMD 25/08/2022 Up to 5.00 Pt 25/08/2022 Up to 5.00 Pt	seized the Hypothe ne parties and same ed Vehicle Auction N <b>f</b> Inspection Date & Time of the Vehicle 23/08/2022 02.00 pm To 4.00 M 23/08/2022 02.00 pm To 4.00 M	cated Motor Vef e is being auction date & time 26/08/2022 From 02.00 P to 06.00 PM 26/08/2022 From 02.00 P to 06.00 PM	E icle mentioned oned on "AS IS Branch Nar and Mobile M Khodiyar N M No. 9909023083 M No. 9687689118

## વંદે ગુજરાત - ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ વડોદરા જિલ્લાના ૮ તાલુકાઓને વધુ વિકસિત કરીને વંદે ગુજરાત વિકાસ ચાત્રા પૂર્ણ

!, પરંતુ છેવાડાના માનવી સુધી વિકાસકાર્યોની મહેક પહોંચે, ઘર-ઘર સધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે, લોકોને તેની યોગ્ય અને ઉપયોગી જાણકારી મળી રહે તે માટે ડબલ એન્જિનની સરકાર મક્કમ છે. અને આ જ મક્કમતા. દ્રઢ નિશ્ચય સાથે

વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમ્હૂર્ત અને જાહેરાત કરવામાં આવી હતી. આવી રીતે, કરજણ તાલુકામાં કુલ રૂ. ૨૨૩ લાખના ૧૧૪ વિકાસકાર્યો, વાઘોડીયા તાલુકામાં કુલ રૂ. ૧૧૬.૨૦ લાખના ૫૦ વિકાસકાર્યો, ડભોઇ તાલુકામાં રૂ. ૮૧.૩૮ લાખના ૩૫ વિકાસકાર્યો, પાદરા તાલુકામાં કુલ રૂ. ૧૩૪ લાખના ૫૧ વિકાસકાર્યો, સાવલી તાલુકામાં કુલ રૂ. ૧૦૮ લાખના ૨૪ વિકાસકાર્યોના લોકાર્પણ-

દરમિયાન લાભાન્વિત લોકોની વાત કરીએ તો, વડોદરા તાલુકામાં ૩૨૧ લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભો અર્પણ કરવા સાથે વાઘોડીયા તાલુકામાં ૩૫૦, ડભોઇ તાલુકામાં ૨૫૩, કરજણ તાલુકામાં ૧૨૦, પાદરા તાલુકામાં ૨૧૮ તેમજ સાવલી તાલુકામાં ૨૧૭ લોકોને વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં

વિકાસ યાત્રાનો શાહી રથ વડોદરા જિહ્વાના જે ગામ કે વિસ્તાર સુધી પહોંચ્યો, ત્યાં વિકાસકાર્યો કરવાની સાથે અનેક લોકોને સરકારી યોજનાઓથી લાભાન્વિત કર્યા, તો ગુજરાતના છેક્ષા બે દાયકામાં વિવિધ ક્ષેત્રે હાંસલ થયેલ સિદ્ધિઓની અને વિકાસની હરણફાળના દર્શન કરાવતી રસપ્રદ ફિલ્મોને એલ.ઇ.ડી સ્ક્રીન પર લોકોએ કુતૂહલવશ નિહાળી હતી. અને પોતાના ગામને વિકસિત જોઇને અને વધુ વિકાસની ભેટ મળતા ભાવવિભોર થઇને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ખોબલે ને ખોબલે આભાર વ્યક્ત કર્યો હતો.


વડોદરા, તા.૨૦ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત વંદે ગુજરાત વિકાસ યાત્રાનં આજે વડોદરા જિલ્લા સહિત રાજ્યભરમાં સમાપન થયું છે. તા.પ જુલાઇએ વડોદરા તાલુકાના પોર ગામ અને ડેસર તાલુકાનાં ડેસરથી પ્રસથાન થયેલા વિકાસ યાત્રાના રથોએ આ યાત્રા દરમિયાન જિલ્લાના ૮

તો ક્યારેક ઝરમર અને ક્યારેક

વિકાસ યાત્રાના રથોએ જિલ્લાભરમાં પરિભ્રમણ કર્યું હતું. ઘર-ઘર સુધી ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન થયેલા કરીએ તો, વડોદરા તાલુકામાં કુલ રૂ.

આવ્યા હતા.

ખાતમહુર્ત કરવામાં આવ્યા હતા. યાત્રા રમતગમત પ્રત્યેની નિરંતર બિનશરતી પ્રતિબદ્ધતા ચથાવત રાખતા



રહ્યા છે.

ઉઘાડ જોવા મળી રહ્યો છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન જિલ્લામાં હવામાન અને પરિસિથતિઓ બદલાતી રહી, પરંતુ વિકાસ યાત્રાનો વેગ અવિરત અને અચળ રહ્યો. વરસાદ હોય કે તડકો, કે પછી ઝરમર મહેર વચ્ચે વાદળછાયું વાતાવરણ કેમ ન હોય

RIL ક્રિકેટ સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગમાં ફ્રેન્ચાઇઝીનું રિલાયન્સ પરિવારમાં કરે છે સ્વાગત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આજે ક્રિકેટમાં તેની વધતી આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવતા જાહેરાત કરી છે કે તે ક્રિકેટ સાઉથ આફ્રિકાની આગામી ⊤૨૦ લીગમાં ફેન્ચાઇઝી હસ્તગત કરશે. UAE-સ્થિત ઈન્ટરનેશનલ લીગ ⊤-૨૦ ટીમ ખરીદ્યા બાદ તુરંત જ ખરીદવામાં આવેલી કેપટાઉન સ્થિત આ નવી ક્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડને આગળ ધપાવશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ક્રિકેટ ક્રેન્ચાઈઝીની માલિકી, ભારતમાં કટબોલ લીગ, સ્પોર્ટ્સ સ્પોન્સરશિપ, કેન્સલ્ટન્સી અને એથ્લેટ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા રમતગમતની

એથ્લેટ્સને વિવિધ રમતોમાં ચેમ્પિયન બનવાની તકો પૂરી પાડીને અને વૈશ્વિક રમતગમતના કાર્યક્રમોન્ આયોજન કરવામાં ભારતના મહેચ્છાનું નેતૃત્વ કરીને ભારતની ઓલિમ્પિક ચળવળનું નેતૃત્વ કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં અંબાણીએ ૪૦ વર્ષના અંતરાલ પછી ૨૦૨૩માં મંબઈમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું આયોજન કરવા માટે સફળ બીડનું નેતૃત્વ કર્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર

નીતા અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ

પરિવારમાં અમારી નવી ⊤૨૦ ટીમનં

અને અમે આ સહયોગની શક્તિ અને સંભવિતતાની શોધખોળ કરવા આતુર છીએ. જેમ જેમ અમે Mાની વૈસ્વિંક ક્રિકેટિંગ ફટપ્રિન્ટમાં વધારો કરીએ છીએ, તેમ તેમ અમે રમત દ્વારા આનંદ અને ઉદ્વાસ પ્રસારિત કરવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ! રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે, અમારી સાઉથ

છીએ! સાઉથ આફ્રિકામાં

રમતગમતની મજબૂત ઇકોસિસ્ટમ છે

આફ્રિકાની ફ્રેન્ચાઇઝી સાથે અમારી પાસે હવે ત્રણ દેશોમાં ત્રણ ⊤૨૦ ટીમો 63.

અમે ક્રિકેટ ઇકોસિસ્ટમ અને બ્રાન્ડ મંબઈ ઈન્ડિયન્સમાં અમારી કશળતા અને જ્ઞાનના ઊંડાણનો લાભ લેવા આતુર છીએ જેથી ટીમ બનાવવામાં મદદ મળી શકે અને ચાહકોને ક્રિકેટના ેકટલાક શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરી શકાય.

### વડોદરામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ยิเรด นิย์ดิว่า นร์ญโนดู่ आขาชด પ્રવેશ મળશે. વર્કશોપ તા. ૨૫/૦૭/

૨૦૨૨ થી ૨૯/૦૭/૨૦૨૨ દરમ્યાન આયોજન કરેલ છે જેમાં ૬

થી ૧૪ વર્ષ સુધીના ૧૦૦ બાળકો

જોડાવા ઇચ્છતા વડોદરા શહેર તથા

જિહ્વાના ૬ થી ૧૪ વર્ષના વિદ્યાર્થીઓ

નિયત નમુનાનાં અરજી કોર્મ જીક્ષા

રમત ગમત અધિકારીની કચેરી.

વડોદરા શહેર, જિલ્લા યુવા વિકાસ

અધિકારીની કચેરી સી - બ્લોક, ૮મો

આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપમાં

ભાગ લઈ શકશે.

વડોદરા, તા.૨૦ બાળકોમાં રહેલી ચિત્રકલાની રુચિ વિકસે તેમજ ચિત્રકલાના વિવિધ માધ્યમો વિશે બાળકો જાણકારી મેળવે તેવા ઉમદા હેતુથી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત '' આઝાદી કા અમૃત મહોત્સવ'' અન્વયે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્ષમતા માટેરૂ. ૨૮.૪૮ કરોડનો સમાવેશ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ થાય છે. તદઅનુસાર, નગરપાલિકાઓમાં જાગૃત થાય તે હેતુથી અવનવી ચિત્રકલાની રીત તથા ચિત્રકલાના માધ્યમો વિશે આ વર્કશોપમાં માહિતગાર કરવામાં આવશે. આ વર્કશોપમાં ૧૦૦ વિદ્યાર્થીઓની મર્યાદા એમએલડી ક્ષમતાના એસટીપીના કામો હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે

# રાજ્યની ૯ નગરપાલિકાઓમાં સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ. ૧૮૮.૧૨ કરોડના કામોને મુખ્યમંત્રીની મંજૂરી

અભિગમના ભાગરૂપે ૨૦૨૨-૨૩માં

આ નગરપલિકાઓમાં ગંદા પાણીના

શુદ્ધિકરણ માટે અઘતન ટેક્નોલોજી

ધરાવતા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા

તે સંપૂર્ણતઃ કાર્યરત રહે તે માટે જરૂરી

સંલગ્ન આનુષાંગિક કામો માટે આ રૂ.

૧૮૮.૧૨ કરોડના કામો મંજૂર કર્યા છે.

જે ૯ નગરપાલિકાઓમાં નવા સુએઝ

ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરાયું છે

તેમાં ગઢડા એસટીપી ૬.૩

એમએલડીની ક્ષમતા માટે રૂ. ૨૩.૨૯

કરોડ, કઠલાલ એસટીપી ૪.પ

એમએલડીની ક્ષમતા માટે રૂ. ૧૪.૦૨

કરોડ, મહુધા એસટીપી ૪

એમએલડીની ક્ષમતામાટે રૂ. ૧૦.૦૦

કરોડ, પાટડી એસટીપી ૩.૪

એમએલડીની ક્ષમતા માટે રૂ. ૯.૬૮ કાર્યરત છે.

છે. રાજ્યમાં પર્યાવરણ જાળવણીના કરોડ, સાવરકુંડલા એસટીપી ૧૩.૪૦

એમએલડીની ક્ષમતા માટે રૂ. ૩૦.૫૬

કરોડ. બાયડ એસટીપી પ.૦૭

એમએલડી તથા 0.૩૧ એમએલડીની

ક્ષમતા માટે રૂ. ૧૩.૧૭ કરોડ, સિદ્ધપર

એસટીપી ૧૩.૫૦ એમએલડીની

ક્ષમતા માટેરૂ. ૪૮.૩૧ કરોડ, સોજીત્રા

એસટીપી ૨.પ એમએલડીની ક્ષમતા

માટે રૂ. ૧૦.૬૧ કરોડ અને વક્ષભ

વિદ્યાનગર એસટીપી ૨૧ એમએલડીની

કુલ ૧૪૯૭ એમએલડી ક્ષમતાના રૂ.

વે૮પ૦ કરોડના ૧૬૧ એસટીપીના કામો

અગાઉ મંજૂર કરવામાં આવેલા છે

તેમાંથી પહ નગરપાલિકાઓમાં ૭૨૦

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૨૦ રાજ્યના ખેડા, આણંદ, અમરેલી, બોટાદ, સરેનદ્રનગર, મહેસાણા અને સાબરકાંઠા જિક્ષામાં આવેલી ૯ નગરપાલિકાઓમાં કુલ ૭૩.૯૮ એમએલડી ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. ૧૮૮.૧૨ કરોડના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્યુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અઘતન ટેક્નોલોજી આધારિત એસટીપી કામો હાથ ધરવામાં આવે

# નવી અને રિન્યૂએબલ એનર્જી તથા ઊર્જા મંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનજીનીં કલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના મામલે ૩૦મી જૂન ૨૦૨૨ની સ્થિતિએ ૧૯,૪૧૪.૮૭ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામે છે. ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી તથા ઊર્જો મંત્રી શ્રી આર.કે. સિંઘ દ્વારા રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં ૧૯ જુલાઈ ૨૦૨૨ના રોજ રાજ્યસભામાં ઉપરોક્ત માહિતી રજૂ કરવામાં આવી હતી. ઊર્જા મંત્રીના નિવેદન મુજબ, ગુજરાતની ૧૯,૪૧૪.૮૭ મેગાવોટની રિન્યૂએબલ એનજીનીં કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ૯૪૧૯.૪૨ મેગાવોટ પવન ઊર્જા, ૭૮૦૬.૮૦ મેગાવોટ સૌર ઊર્જા, ૧૯૯૦ મેગાવોટ મોટી હાઈડ્રો પાવર યોજના, ૧૦૯.૨૬ મેગાવોટ બાયો પાવર અને ૮૯.૩૯ મેગાવોટ નાની હાઇડ્રો પાવર યોજનાનો સમાવેશ થાય છે. નથવાણી દેશમાં રિન્યૂએબલ એનજીની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી તેમજ ઉત્પાદન તથા ભારતમાં રિન્યૂએબલ એનજીનેં

પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી/આવનારી વિવિધ યોજનાઓ વિશે જાણવા માગતા હતા. ઊર્જા મંત્રીના નિવેદન અનુસાર, સરકારે નાના ગ્રીડ કનેક્ટેડ સોલાર એનર્જી પાવર પ્લાન્ટ્સ, સ્ટેન્ડ-અલોન સોલાર પાવર્ડ એગ્રીકલ્ચર પંપ અને હાલના ગ્રીડ સાથે જોડાયેલા કૃષિ પંપના સોલરાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે ઙખ-ઊંગજ્બખ સ્કીમ શરૂ કરી છે. આ યોજના માત્ર ખેડૂતો માટે જ નહીં પણ રાજ્યો અને વીજ વિતરણ કરતી કંપનીઓ એટલે કે ઉઇંજ્ઈઘખત માટે પણ ફાયદાકારક છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું કે રાજ્યો કૃષિ ગ્રાહકોને વીજળી માટે આપવામાં આવતી સબસિડી પર બચત કરશે અને DISCOMsને દ્રાન્સમિશન અને વિતરણના નુકસાનને બચાવવા માટે વિતરણ માળખામાં છેક છેવાડા સધી સસ્તી સોલાર ઊર્જા મળશે. ઊર્જા મંત્રીના જણાવ્યા અનુસાર, ૪૦,૦૦૦ મેગાવોટ ક્ષમતાની સ્થાપનાના લક્ષ્ય માટે સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સના વિકાસ

માટેજમીન, રસ્તાઓ, ટ્રાન્સમિશન સિસ્ટમ (આંતરિક અને બાહ્ય), પૂલિંગ સ્ટેશન, પાણી ઉપલબ્ધ થવાની શક્યતાઓ જેવી માળખાકીય સુવિધાઓની સાથે તમામ વૈધાનિક પરવાનગીઓ/મંજૂરીઓ સાથે યોજના તૈયાર કરવામાં આવી છે. આમ, સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સને પ્લગ એન્ડ પ્લે જેવી ઝડપથી કામ કરવાની અનુકૂળતા મળી રહી છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું ેક સરકારે ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ 'નેશનલ પ્રોગ્રામ ઓન હાઇ એફિશિયન્સી સોલર પીવી મોડ્યુલ્સ' શરૂ કરી છે. મંત્રાલયે ગ્રીડ સાથે જોડાયેલા સોલાર ઋટોપ પાવર પ્લાન્ટ્સ માટે સ્કટોપ સોલર પ્રોગ્રામ ફેઝ ટ્ર પણ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ રેસિડેન્શિયલ સેક્ટર માટે સબસિડી પૂરી પાડવામાં આવે છે અને DISCOMsને નિર્ધારિત મર્યાદાથી વધુ ક્ષમતા હાંસલ કરવા માટે પર્ફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

### મિર્ચી ૯૮.૩ એ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણની શરૂઆત કરી

શકાશે.

મિર્ચી ગ્રીન યોદ્ધાના અંતર્ગત કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આ એક્ટિવિટીની શરૂઆત થઇ મિર્ચીએ છેલા ૬-૭ વર્ષથી લગભગ ૬૦,૦૦૦ થી વધુ વક્ષો શહેરમાં વાવ્યા છે. શહેરીજનો માટે મિર્ચી અને ∨MC ભેગા થઈને સમગ્ર શહેરમાં છોડવાઓનું વિતરણ કરી રહ્યા છે. તેની શરૂઆત કાઇનેટિક ગ્રીન શોરૂમના ઉદઘાટન સાથે થઇ. વાતાવરણમાં પ્રદૂષણ ને નાથવા જરૂરી ઈલેક્ટ્રીક ટ્રુ વહીલરના શોરૂમના ઉદઘાટન અને ગ્રીન યોલ્દાના નાદ સાથે વડોદરા શહેરમાં વધુ હરિયાળી ફેલાવવા હાજર શહેરીજનોએ સંકલ્પ કર્યો. સાથે જ સાંસદસભ્ય રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર કેયુર રોકડીયા, સ્ટેન્ડિંગ

### કાર્બન ઉત્સર્જન ઘટાડવા મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટની પ્રસંશનીય પહેલ

(પ્રતિનિધિ)અમદાવાદ, તા.૨૦ એરર્પોર્ટને કાર્બન ન્યૂટ્રલ બનાવવાની દિશામાં એએએચએલ હેઠલના મેંગ્લુરુએરપોર્ટે અનોખી પહેલ હાથ ધરી છે. મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટે (એમઆઇએ)એ ૨૦૨૪ સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાના અને ૨૦૨૯ સુધીમાં નેટ ઝીરો થવાના પ્રયાસ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી છે. મેંગ્લુરુ એરપોર્ટે પ્રથમવાર ઇલેક્ટ્રિક એસુવી ખરીદી તેના ચાર્જીગ સ્ટેશન બનાવવાનું કામ હાથ ધર્યુ છે. ઇલેક્ટ્રિક વાહનોંનોના ઉપયોગથી એરપોર્ટ પર થતાં કાર્બનનાં ઉત્સર્જનમાં ઘટાડો થશે.નવા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (એસુવી)નો ઉપયોગ એરપોર્ટ પર એન્જિનિયરિંગ મેન્ટેનન્સ અને લેન્ડ-સાઇડ ઓપરેશન્સ ટીમ દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ પર ઇલેક્ટ્રિક ડ∪∨ને કાર્યરત કરી ઈલેક્ટિકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવાની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે. એરપોર્ટે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં નવી ઇલેક્ટ્રિક બસ અથવા એસયૂવી ખરીદવાની યોજના પણ તૈયાર કરી છે. એરપોર્ટના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સ્ટેક હોલ્ડર્સ તેમજ અન્ય લોકોને પણ તેની સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોનોના ઉપયોગથી એરપોર્ટ પર થતું કાર્બન ઉત્સર્જન ઘટશે અને તેકાર્બન ન્યૂટ્રલ બનવાની

પણ તેઓએ આયોજનમાં હાજરી આપીને,છોડ વાવીને વડોદરા શહેરને વધ્ ગ્રીન બનાવવા શહેરીજનોને અપીલ કરી હતી. મિર્ચી ગ્રીન યોદ્ધામાં મિર્ચી૯૮.૩ ના પોપ્યુલર આર જે મોહિની અને આર જે પૂજાએ આ ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતા. રેડિયો મિર્ચીનું આ કેમપેઇન આગામી ૧ મહિના સુધી કાર્યરત રહેશે. મિર્ચી સાથે રજીસ્ટ્રેશન કરાવીને કોઈપણ વ્યક્તિ ઐચ્છિક છોડ લઈને પોતાના ઘરે વાવી શકે છે.

અને કોર્પોરેટર - રીટાબેન સિંઘ,

મનીષ ભાઈ પગાર, સ્મિત પટેલ તથા

શહેરના પ્રખ્યાત કોમેડિયન ચિરાય

મિસ્ત્રી હાજર રહ્યાહતા. એટલું જ નહિ

દિશામાં મહત્વનું પગલુ સાબિત થશે. GatewayToGoodness હેઠળ માર્ચ ૨૦૨૫ સુધીમાં પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટેની આ પહેલ છે.

એક શિક્ષકની ધગશથી ગામની બહેનો માટે શરૂ થયો સીવણ તાલીમ વર્ગ

## 30 વર્ષની ઉમરે ચેતનભાઈ બ્રેઈનડેડ થતા અગદાન થકી ૪ પીડીત વ્યક્તિઓનો આધાર બની ગયા

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૨૦ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૦ મું અંગદાન થયું છે. ૩૦ વર્ષના ચેતનકુમાર ચૌહાણ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણય થકી હ્રદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું છે. ચેતનભાઇનું હ્રદય ઘબકતું ઘબકતું શરીરમાંથી નીકળીને પ૨૫ કિ.મી.નું અંતર ખેડી મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ ૪૨ વર્ષના દર્દીમાં પ્રત્યારોપણ થવા પહોંચ્યું હતું. ગ્રીનકોરિડોર મારફ્તે ૮ મીનિટ કરતા પણ ઓછા સમયમાં અમદાવાદ એરપોર્ટ પહોંચીને ત્યાં કાર્યરત ફ્લાઇટમાં તહેનાત તબીબી ટીમ દ્વારા હ્રદયને લઇને અન્ય પીડિત દર્દીને નવજીવન આપવાની ઉડાણ ભરવામાં આવી હતી. ત્યારબાદ ૫ કલાકની સર્જરીના અંતે સફળતાપૂર્ણ હ્રદયનું પ્રત્યારોપણ

અન્ય દર્દીમાં થયું હતું. જ્યારે ચેતનભાઇની બે કિડની અને લીવરમાં સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું હતું.ચેતનભાઇ નાની ઉમ્રમાં માતા-પિતાનો આધાર ગુમાવીને નિરાધાર બન્યા હતા. થોડા સમય બાદ એક ભાઇનો પણ સંગાથ ગુમાવ્યો. જેના કારણે તેઓ જીવનનું મૂલ્ય સમજતા હતા. આ તમામ સંધર્ષમય પરિસ્થિતિમાંથી બહાર નિકળીને હજું માંડ તેઓ પગભર બન્યા હતા ત્યા ૩૦ વર્ષની નાની ઉમ્રે ૧૨ મી જુલાઇના રોજ તેમને ગંભીર માર્ગ અકસ્માત નડ્યો. માર્ગ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચતા તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. ઇજા અત્યંત ગંભીર હતી. તબીબોએ

અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપ પર આવકવેરાના દરોડા, ૪૦ સ્થળે તપાસ

(પ્રતિનિધિ)અમદાવાદ, તા.૨૦ અમદાવાદમાં કરીથી ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધરીને ટેક્ષટાઇલ, શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલ ચિરીપાલ ગ્રુપ પર દરોડા પાડચા છે. ચિરીપાલ ગ્રુપની શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસની સાથે ચિરીપાલ ગ્રુપના વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તેની સાથે બોપલમાં આવેલી ઓફિસ સહિત ૩૦થી ૪૦ જગ્યા પર દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. આ મેગા સર્ચની કામગીરીમાં આશરે ૧૫૦ જેટલા

અધિકારીઓ જોડાયા છે. આ દરોડ દરમિયાન દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનીક પૂરાવા એકત્રિત કરાશે. આ તપાસ પૂર્ણ થયા બાદ કરોડની કરચોરી બહાર આવવાની શક્યતા સેવાય છે. અમદાવાદ શહેરમાં ફરીથી આવકવેરાના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર મંગળવારે મોડીરાતથી જ અમદાવાદ અને સુરતની ચિરીપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરમાં ઘણા સમયથી આઇટીના દરોડા ચાલી રહ્યા છે ત્યારે ચિરીપાલ સહિત નંદન ડેનિમ અને વિશાલ ડેનિમમાં પણ વિભાગે તપાસ શરૂ કરી છે.

દિવસ – રાત રાઉન્ડ ધ ક્લોક સધન સારવાર હાથ ધરી છતા છેક્ષે ઇશ્વરને ગમ્યું તે જ બન્યું. ૭ દિવસની સધન સારવારના અંતે તબીબો દ્વારા ચેતનભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સિવિલ હોસ્પિટલના તબીબ ડો. નિલેશ કાછડીયા અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સ્વંયસેવકો દ્વારા સમજાવતા પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંગદાનની સંમતિ મબ્યા બાદ ચેતનભાઇને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. રીટ્રાઇવલ સેન્ટરમાં ૭ કલાકની મહેનતના અંતે હ્યદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલે આદરેલો અંગઠાનનો સેવાયજ્ઞ

આજે જન જનમાં મદદની મુહિમ બન્યો પશ્ચિમ રેલવે – વડોદરા ડિવિઝન છે. સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાનની વિવિષ ઈલેક્ટ્રિકલ કાર્યો રોજબરોજની જનજાગૃતિના પરિણામે દે-ડર આમંત્રિત નોટીસ EL/50/1/09 (22-23) Dt.15-07-2022 આજે લોકો સ્વૈચ્છાએ પણ અંગદાન માટે મ્ના રાષ્ટ્રપતિ માટે અને વતી ડિવિઝનલ રેલવે મેને! લેકદીકલ), પશ્ચિમ રેલવે, વડોદરા દિવિઝન ૯ સંમતિ આપતા થયા છે. અંગદાનની તુભવી અને વિશ્વસનીય કોન્ટ્રાકટરો તરફ થી ભારતી કવેની વેબસાઈટ www.ireps.gov.in પર ઈન્ટેન્ડ ટાર્બરેસ કરે છે. **અનું નં** 1ર કેન્ડર નં. BRC-EL-P સમગ્ર પ્રવૃતિ સાથે સંકળાયેલા તબીબ 37-094252-21-22R. **કામનું નામ**ા વડોદર ડિવિઝન દેરોલ અને પાલેજ સ્ટેશનો ખાતે રેલ ગ્રાઈન્ડિ ડો. નિલેશ કાછડિયા જણાવ્યું હતું કે, દર્દીને બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શીન સાઈડીંગ અને કોસાદ, ક્રેસંબા, સેવાલીય દરેજડી, નાંદેજ અને મોડેલી સ્ટેશનો ખાતે ટ્રેક પક્ષી પરિવારજનોને અંગદાન માટે કાઉન્સેલીંગ ઈડીંગ્સ પર જોડાયેલ સુવિધાઓના પુનર્વસનના સંબંધ લેક્ટ્રિકલ કાર્ય. વડોંદરા ડિવિઝના આણંદ અ તેમદાવાદ અને ખેડા રોડ સ્ટેશનો ખાતે ટ્રેક મશી કરવું શરૂઆતના સમયમાં અત્યંત પડકોરજનક હતું. પરંતુ સમાજસેવી ાઈડીંગ્સ પર યોડાયેલ સુવિધાઓના પુનર્વસન સહિત વેક્ટ્રિકલ કાર્ય, વડોદરા ઉવિડાનઃ પેટલાદ અને કપડવંધ સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી શનો ખાતે ટ્રેક મશીન સાઈડીંગ્સ માટે જોડાયે વિયાઓના પુનર્વસનના સંબંધમાં ઉલેક્ટ્રિકલ કાર્ય **દંદાજીન ૨કમઃ ૨** 21,01,086.00, **ઈએમડી** સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તેલી 42,000.00, ઈ-ટે-ડર બંધ થવાની તારીખ જનજાગૃતિના પરિણામે આજે u.16-08-2022. વેખસાઈટ વિગત કાઉન્સેલીંગમાં ખૂબ જ ઓછો સમય www.ireps.gov.in ઓફિસનું સરનામું: સિની વિઝનલ ઈલેસ્ટ્રિકલ એન્જીનીયર (પાલર), પશ્ચિમ રેલ લાગે છે વળી ઘણાંચ પરિવારો સ્વૈચ્છાએ ભર, વડોદસ-390004. અંગદાન માટેની ઇચ્છા દર્શાવે છે. आग्ले होतो जो: 🔛 twitter.com/WesternRly

વડોદરા, તા.૨૦ સાવલી તાલુકાના ચોરપૂરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય

આરીફખાનની ધગશ અને નિષ્ઠા તેમજ સેવા સંસ્થાના સહયોગ થી ગામની મહિલાઓ માટે સીવણ તાલીમ વર્ગ શરૂ થયો છે. ગ્રામીણ મહિલાઓનો મોટાભાગનો સમય ઘરકામ અને ખેતીકામ,પશુ સારસંભાળમાં જતો હોય છે. જો કે તેઓ તેમાં થી પણ સમય કાઢી લે છે ત્યારે તેમને કોઈ હુનર ની તાલીમ મળે તો તેઓ આ સમયનો ઉપયોગ કરીને પુરક આવક મેળવી શકે તેવા વિચારમાં થી આ વર્ગ શરૂ થયો છે. સમન્વય ટ્રસ્ટ આરીફભાઈની પ્રાથમિક શાળાના બાળકોને સંધ્યા ભોજન સહિત વિવિધ મદદ કરે છે. આરીફભાઈ એ પોતાનો વિચાર સમન્વય ટ્રસ્ટના સંચાલકો પાસે રજૂ કર્યો અને તેમના સહયોગ થી ગુરુ પૂર્ણિમા થી આ વર્ગ શરૂ થયો છે.

> <u> બાંધકામના કામો</u> ડીવાય.ચીક- એન્જિનિયર (બાંધકામ), પશ્ચિ રેલવે, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪, ની<sup>ર</sup> આપેલ વિગતો મુજબ ઇ-ટેન્ડર આમંત્રિત છે: ઇ-ટેન્ડર નંબર Dy.CE/C/I/BRC ANND-GDA/06/R નામ કાર્યનું: સ્ટેશન બિલ્ડીંગનું બાંધકામ, પ્લેટફોર્મ, પ્લેટફોર્મ દિવાલ એફઓબી, સ્ટેજીંગ સાથેની પાણીની ટાંકી એપ્રોચ રોડ, આરસીસી બાઉન્ડ્રી વોલ, ફેન્સીંગ પાણી પુરવઠાની વ્યવસ્થા, ટોયલેટ બ્લોક વોટર હટ્સ, સ્ટાફ ક્વાર્ટર્સ, એસ એન્ડ સ્ટ્રક્ચર્સ, ઇલેક્ટ્રિકલ સ્ટ્રક્ચર્સ, એલ.સી આણંદ-ગોધરા ડબલીંગ પ્રોજેક્ટ સંદર્ભે આણંદ ગોધરા વિભાગ વચ્ચે ડ્યુટી બંક વગેરે. અંદાજિત ખર્ચ કાર્ય: ગ્ન.૮૭,૮૪,૨૯,૩૩૩.૭૧/- જ કરાવવાના બાનાના નાણાં: રૂા.૪૫,૪૨,૨૦૮ -પ્રી-બિડ કોન્ક્રરન્સઃ ૨૫.૦૭.૨૦૨૨ ના રોજ યોજાનારી બિડિંગ માટે ઑનલાઇન ટેન્ડરન ઉપલબ્ધતાઃ ૦૨.૦૮.૨૦૨૦૨૦૨૦૨ સુધી ૧૫:૦૦ કલાક સુધી. નોંધ: ૧) વિગતવાર સૂચના ઇએમડી, પાત્રતા માપદંડો, સમાન કાર્યની પ્રકૃતિ વિગતવાર ટેન્ડર શરતો, કૃપા કરીને www.ireps.gov.in ની મુલાકાત લો. Like us on 📊 facebook.com/WesternRiv

ઈકોસિસ્ટમને વિકસિત કરવામાં અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વધુમાં, રિલાયન્સ ફાઉન્ડેશન સ્પોર્ટ્સ -RILની CSR પાંખ દેશભરના

m

સ્વાગત કરતાં મને આનંદ થાય છે! અમે મુંબઈ ઈન્ડિયન્સની નીડર અને મનોરંજક ક્રિકેટ બ્રાન્ડને સાઉથ આફ્રિકામાં લઈ જવા માટે ઉત્સાહિત છીએ, જે રાષ્ટ્ર ક્રિકેટને એટલો જ પ્રેમ કરે છે જેટલો આપણે ભારતમાં કરીએ



### જીંદાલ હોટેલ્સ લિમિટેક

CIN: L18119GJ1984PLC006922

GRAND MERCURI રજીસ્ટર્ડ ઓફિસ : ગ્રાન્ડ મરકચોર વડોદરા સુર્યા પેલેસ, સચાજીગંજ, વડોદરા-૩૯૦૦૨૦. ફोन : ०२९૫-२३९३३९९/२२२९०००/२२२९२९. ઈ-મેઈલ : <u>share@suryapalace.com</u> वेબસાઇટ : <u>www.suryapalace.com</u>

### કંપનીના ઇક્વીટી શેરઘારકો જોગ નોટીસ

#### કંપનીના ઇકવીટી શેર્સ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ) માં તબદીલ / હસ્તાંતરણ કરવા બાબત.

કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૨૪(૬) અને ધી ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફર એન્ડ રીફન્ડ) રૂલ્સ, ૨૦૧૬ (ધી રૂલ્સ) કે જે મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા સૂચિત કરાયેલ છે અને તા. સપ્ટેમ્બર ળ, ૨૦૧૬ થી અમલીકરણથી લાગુ પડતી જોગવાઈઓ અને તેમાં કરવામાં આવેલા વખતો-વખતના સુધારા હેઠળ આ સૂચના આપવામાં આવે છે.

આ નિયમો, અન્ય બાબતોની સાથે, સતત સાત વર્ષ કે તેથી વધુ સમયથી જે ઇક્વીટી શેર્સનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું નથી કે શેરધારકો દ્વારા તે મેળવવા માટે દાવો કરવામાં આવ્યો નથી, એવા ઇક્વીટી શેર્સને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ) ઓથોરીટીના નામે હસ્તાંતરણ કરવાની જોગવાઇ ધરાવે છે.

કંપનીના રેકોર્ડસ પરથી જાણવા મળે છે કે કંપનીના કેટલાક શેરધારકોએ તેમનાં અનપેઇડ / અનક્લેઇમ્ડ ડિવિડન્ડ સન્ નાણાંકિય ૨૦૧૪-૨૦૧૫ નાં વર્ષથીશરૂ કરીને છેલ્લા સતત સાત વર્ષનાં ડિવિડન્ડ વોરન્ટસ વટાવેલ નથી.

સંબંધિત રૂલ્સમાં ઠરાવવામાં આવેલી વિવિધ આવશ્યકતાઓનું પાલન કરતાં, કંપનીએ તેવા તમામ સંબંધિત શેરધારકો કે જેમના ઇક્વીટી શેર્સ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન આઇઇપીએફ ઓથોરીટીને ઉપરોક્ત નિયમો દેઠળ હસ્તાંતરણ કરવાને પાત્ર છે, તેમને તેની વ્યકિતગત રીતે જાણ કરેલ છે. કંપનીની વેબસાઇટ <u>www.suryapalace.com</u> ઉપર જેમના શેર્સ આઇઇપીએફ ઓથોરીટીના ડિમેટ એકાઉન્ટમાં તા. ૨૭.૧૦.૨૦૨૨ ના રોજ હસ્તાંતરણ કરવાને પાત્ર થાય છે તેવા તમામ શેરધારકોની વિગતો મૂકેલ છે. સંબંધિત શેરધારકોને આથી વિનંતી કરવામાં આવે છે કે આઇઇપીએફ ઓથોરીટીને હસ્તાંતરણ કરવા પાત્ર શેર્સની વિગતો ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી ચકાસી લેવી.

શેરધારકો વધુમાં નોંધ લે કે, કંપની દ્વારા તેની વેબસાઇટ ઉપર ઉપરોક્ત લાગતા-વળગતા શેરધારક(કો)ની જે વિગતો દર્શાવવામાં આવી છે તેને કંપની / કોર્પો રેટ એક્શન દ્વારા નિયમો અનુસરીને આઈ.ઈ.પી.એફ ડિમેટ એકાઉન્ટમાં શેરોને હસ્તાંતરણ કરવાની બાબતમાં અને નવા શેર પ્રમાણપત્ર/પત્રો જારી કરવાની બાબતમાં જરૂરી નોટીસ તરીકે ગણવાની રહેશે.

જો તા. ૩૦.૦૯.૨૦૨૨ સુધીમાં કંપનીને આ બાબતમાં સંબંધિત શેરધારકોની કોઇ રજુઆતો નહીં મળે, તો કંપની, સંબંધિત નિચમોની જોગવાઇઓનું પાલન કરવા, નિચમોમાં જે કાર્ચ પધ્ધતિ દર્શાવી છે તેને અનુસરીને અને કોર્પોરેટ એક્શન દ્વારા સંબંધિત શેર્સને આઇઇપીએફ ઓથોરીટીને હસ્તાંતરણ કરશે. અત્રે એ નોંધ લેવી કે સંબંધિત નિચમો પ્રમાણે દાવા વિનાનાં ડિવિડન્ડની રકમ અને આઇઇપીએફ ઓથોરીટીને હસ્તાંતરણ કરવામાં આવેલા ઇક્વીટી શેર્સની બાબતમાં કંપની સામે કોઇ દાવો ઉભો રહેશે નહીં.

શેરધારકો એ વાતની નોંધ લે કે આઇઇપીએફ ઓથોરીટીને હસ્તાંતરણ કરવામાં આવેલા દાવા વિનાનાં ડિવિડન્ડ અને સંબંધિત ઇક્વીટી શેર્સ, તેના પર મળવાપાત્ર થયેલા અને થનારા તમામ લાભો સાથે, વેબ ફોર્મ આઇઇપીએફ-પ માં ઓનલાઇન અલાયદી અરજી કરીને પરત મેળવી શકાય છે, અને આવી ઓનલાઇન અરજી પછી વેબ ફોર્મ આઇઇપીએફ-૫ માં દર્શાવેલા દસ્તાવેજોની ભૌતિક નકલો કંપનીને મોકલવાની હોચ છે. સદર ફોર્મ આઇઇપીએકની વેબસાઇટ <u>www.iepf.gov.in</u> ઉપર ઉપલબ્ધ છે.

આ બાબત અને નિચમો અંગે શેરધારકોને કોઈ પૃચ્છા હોય તો, તેઓ કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ મે. લીંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, શ્રી અલ્પેશ ગાંધી, બી-૧૦૨ અને ૧૦૩, શાંગ્રીલા કોમ્પલેક્ષ, પદેલો માળ, એચડીએફસી બેંકની સામે, રાધાક્રિષ્ણ ચાર રસ્તા પાસે, અકોટા, વડોદરા - ૩૯૦ ૦૨૦ (ગુજરાત), ઇન્ડીયા. ફોન : (૦૨૬૫) ૬૧૩૬૦૦૦, ૨૩૫૬૫७૩, ઇમેઇલ: vadodara@linkintime.co.in પર સંપર્ક કરી શકે છે.

	જીદાલ હોટેલ્સ લિમિટેક વર્તી,	
	સહી/-	
સ્થળ : વકોદરા	માનસી વ્યાસ	
તારીખ : ૨૦ જુલાઈ, ૨૦૨૨	કંપની સેક્રેટરી	